



## અવતારનો સિદ્ધાંત

શીતાલ એમ. ચૌધરી

### ૧. અવતાર શબ્દની વ્યુત્પત્તિ

હિંદુ ધર્મનું મુખ્ય અંગ અવતાર છે. કથા, કર્મકાંડ અને ઉપાસના ત્રણાનો સાથે નજીકનો સંબંધ છે. લોકકલ્યાણ માટે અવતારવાદ વિશે જાણવું આવશ્યક છે. આ જ વાત જાણવા માટે પુરાણોમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. અવતાર શબ્દ ‘અવ’ ઉપસર્ગને તૃ ધાતુને ધજ પ્રત્યય લગાડવાથી બન્યો છે. તેનો અર્થ “કોઈ ઊંચા સ્થાનેથી નીચે ઉત્તરવું” એવો થાય છે. આ જ પ્રમાણે ઈશ્વરનું પૃથ્વી ઉપર અવતરણ. ઈશ્વર સર્વજ્ઞ, સર્વત્ર અને સર્વ જગતમાં વ્યાપીને પૃથ્વી ઉપર અનેક રૂપોમાં સ્વયં પોતાની જ માયાથી ઉત્પત્ત થાય છે. તેનો બીજો અર્થ પણ છે. કોઈ શક્તિ સંપત્ત ભગવાન કે દેવતાનું ઊંચા લોકમાંથી ઉત્તરવું તેમજ મનુષ્ય કે માનવેતરરૂપને ધારણ કરવું તેને જ અવતાર કહે છે. આ અર્થમાં પુરાણોમાં આવિર્ભાવ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં અવતાર શબ્દના અનેક અર્થો છે. જેમ કે પાર કરવું, જન્મ ગ્રહણ કરવો, શરીર ધારણ કરવું. નીચે ઉત્તરવું ઈત્યાદિ અર્થ થાય છે. અવતારનો અર્થ ઊંચા સ્થાનેથી નીચા સ્થાને ઉત્તરવું તે “અવતરણ” કે અવતાર એમ કહે છે. ભગવાનનું સ્વરૂપ તો નિરાકાર છે છતાં મહાશક્તિના યોગથી સગુણ આકાર બની ભિન્-ભિન્ રૂપે પ્રતીત થાય છે. પરમાત્મા અજ હોવાથી અનેક રૂપે જન્મ ધારણ કરીને લોકોનું કલ્યાણ કરે છે. ઈન્દ્ર પોતાની માયાશક્તિ વડે અનેકરૂપે પ્રતીત થાય છે. આમ, શ્રુતિઓ દ્વારા સિદ્ધ થાય છે આને જ પરમાત્માનો અવતાર કહે છે.

### ૨. અવતારનું બીજ

અવતારોની વાત ફક્ત પુરાણોમાં જ નથી. પરંતુ, વેદ, ઉપનિષદ, રામાયણ, આરણ્યક, બ્રાહ્મણ, મહાભારતાદિ ગ્રંથોમાં સુંદર રીતે વર્ણન મળે છે.

### ૨.૧ વેદ

ऋવેદના મંત્રમાં ઈન્દ્ર પોતાની માયાશક્તિ દ્વારા ભિન્ ભિન્ રૂપો ધારણ કરતો બતાવ્યો છે. ઋવેદ ૮/૧૭/૧૩ માં ઈન્દ્ર “શુંગવૃષ” ના પુત્રનું રૂપ ધારણ કરનાર માનવામાં આવ્યો છે. ૮ આમ ઈન્દ્રના અવતારનો સ્પષ્ટ આભાસ મળે છે. ઋવેદમાં વિષ્ણુના અવતારનો મંત્ર છે. ૮ જેનું તાત્પર્ય એ છે કે વિષ્ણુએ જગતને ત્રણ ચરણોથી આકાંત કરીને પગ મૂક્યો અને આ પૃથ્વી વગેરે જગત અંતર્હિત થઈ ગયું. ઋવેદના પુરુષસૂક્તમાં વર્ણવેલ “પુરુષ” ને ભાગવત અવતારોનું બીજ ઉદ્ગમસ્થાન, સંહારસ્થાન માનવામાં આવે છે. કૃષ્ણાવતારનું વર્ણન ઋવેદના (૧-૧-૧) મંત્રમાં હોવાનું સ્વામી ગંગેશ્વરાનંદજી માને છે. અથર્વવેદના મંત્રમાં પરમાત્માની સ્ત્રી, પુરુષ, કુમાર અને કુમારીના રૂપે સ્તુતિ કરી છે. જેમાં પરમાત્મા અવતારરૂપે હોવા જોઈએ. અથર્વવેદમાં વરાહ અવતારની વાત છે.

યજુર્વેદમાં અવતાર શબ્દ નહિ પણ “અવતર” શબ્દનો પ્રયોગ થયો છે. ત્યાં અજિન દેવતાને પ્રાર્થના કરવામાં આવી છે કે, પૃથ્વી ઉપર અવતરો. આ મંત્રમાં અવતર શબ્દમાં ઉત્તરવું, નીચે આવવું એવી અર્થધાયા દેખાય છે. શુક્લયજુર્વેદમાં સંહિતામાં પરમાત્મા સ્થૂલ ગર્ભમાં ઉત્પન્ન થાય છે. કોઈ વાસ્તવિક જન્મ લેતો નથી. પણ અનેક રૂપોમાં ઉત્પન્ન થાય છે. આ મંત્રના પ્રાકૃત અર્થમાં અવતારવાદનો અર્થ સ્પષ્ટ થાય છે. ઋગવેદસંહિતામાં અવતારનું આપેલું બીજ બ્રાહ્મણંથોમાં વિસ્તૃત રીતે વિકાસ પામ્યું છે.

## ૨. ૨ બ્રાહ્મણ ગ્રંથો

શતપથ બ્રાહ્મણમાં વામન અવતારની કથાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમજ મત્સ્યાવતારનો રમણીય પ્રસંગ ઉત્પન્ન થાય છે. પ્રજાપતિએ ફૂર્મરૂપ ધારણ કરીને પ્રજાનું સર્જન કર્યાનો પણ ઉલ્લેખ મળે છે. વામન અવતાર વિષ્ણુ સાથે તેમજ મત્સ્ય, ફૂર્મ, વરાહ અવતાર પ્રજાપતિ સાથે સંબંધ ધરાવે છે. તૈત્તિરીય બ્રાહ્મણમાં પ્રજાપતિ દ્વારા વરાહનું રૂપ લેવાની કથા મળે છે. તૈત્તિરીય આરણ્યકમાં ફૂર્માવતારનો નિર્દેશ જોવા મળે છે. જેમાં ઋગવેદના પુરુષસૂક્તને પુરુષનાં દર્શન થાય છે. તથા નૃસિંહ અવતારને નિર્દેશ જોવા મળે છે. જેનું ઉપબૂંહણ માત્ર ભાગવત પુરાણમાં જોવા મળે છે. બૃહદારણ્યક ઉપનિષદ્ધમાં ઈન્દ્રનું માયાશક્તિ અનેકરૂપ ધારણ કરવાનું વર્ણન છે, જે ઋગવેદીય અવતાર સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આમ, અવતારવાદ વેદોથી શરૂ કરીને ઉપનિષદ્ધ, બ્રાહ્મણ, આરણ્યક અને પુરાણોમાં વિસ્તરેલો છે. તેનું વર્ણન સ્વરૂપ રામાયણ મહાભારતાદિ વિપુલકાય ગ્રંથોમાં પણ મળી આવે છે. ભગવાન રામ અને કૃષ્ણ અનુકૂળે રામાયણ અને મહાભારતમાં મહામાનવથી એ વિશેષ અવતારી પુરુષ તરીકે દેખાય છે. આ અવતાર એ ધાર્મિક કાન્તિ છે. તેમાં પરમાત્મા એક વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરીને જગતમાં જુદા જુદા લોકોપ્યોગી કામ કરે છે. અત્યાર સુધી આ અવતારોનો સંબંધ પ્રજાપતિ સાથે હતો પરંતુ, કુમશ: સમય પ્રસાર થતાં વિષ્ણુના અવતારો માનવામાં આવ્યા. પરંતુ વામન અવતારના સંબંધમાં આવું જોવા મળતું નથી. ઋગવેદમાં વિષ્ણુ “ઉરગાય” તથા “ઉરક્રમ” ના વિશેષજાથી વિશેષિત છે. વાસુદેવ કૃષ્ણના વિષ્ણુ અવતાર હોવાથી કુલ્યનાનો ઉદ્ય આરણ્યક યુગમાં થયો. તૈત્તિરીય આરણ્યકમાં તેનો ગાયત્રી મંત્ર મળે છે. પાણિનીયસૂત્રમાં વાસુદેવ તથા અર્જુનની ભક્તિનો ઉલ્લેખ કર્યો છે. વૈષ્ણવ આગમનો ઉદ્ય થવાથી વાસુદેવ કૃષ્ણનું નારાયણની સાથે ઐક્ય સ્થાપિત થયું અને અવતારવાદના વિકાસનો યુગ આવ્યો. ગીતાનો અવતારવાદ શ્રીકૃષ્ણના અવતારવાદ તરીકે વૈષ્ણવધર્મમાં સ્વીકૃત કરવામાં આવ્યો. શ્રીકૃષ્ણના ગીતામાં કહેલા વચનોથી આ બાબતમાં સ્પષ્ટ છે. છાંદોગ્ય ઉપનિષદ્ધમાં શ્રીકૃષ્ણની દેવકીપુત્ર તરીકે ઉપસના કરે છે. ગણેશ, સૂર્ય, શિવ, શક્તિ વગેરેના પ્રસંગો વેદોમાં મળે છે. અને પુરાણોમાં તેના અવતારની ચર્ચા કરવામાં આવી છે.

## ૩. અવતારનો હેતુ

વિશ્વની જુદી જુદી જીતિઓમાં તથા જુદા-જુદા ધર્મોમાં જુદી જ રીતે અવતારનો સિદ્ધાંત પ્રાપ્ત થાય છે. પુરાણ, વેદ અને દર્શનશાસ્ત્રો અનુસાર ઈશ્વર મોતીની માળાના દર્શની જેમ સર્વત્ર વ્યાપક છે. અવતારનું પ્રયોજન એ છે કે જ્યારે સંસારમાં સાધારણ શક્તિથી કામ ન ચાલે ત્યારે ઈશ્વર અવતાર લે છે. વિશ્વને એક સૂત્ર બાંધનાર ધર્મ છે. જ્યારે

જ્યારે ધર્મની જ્ઞાનિ થાય છે. ત્યારે અધર્મનો ઉદ્ય થાય છે ત્યારે ત્યારે ભગવાન વિશ્વમાં જન્મધારણ કરે છે. શ્રીકૃષ્ણ સ્વયં ગીતામાં આ વાત કરે છે. ૨૭ જે નીચેના શ્લોક દ્વારા જણાવવામાં આવે છે.

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।

प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ॥

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम् ॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।

धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥

જે અવતારવાદને કારણે હિંદુ ધર્મ અન્ય ધર્મો કરતાં અલગ પડે છે. તે “અવતારવાદની “શ્રીકૃષ્ણો અહીં ચર્ચા કરી છે. આ અવતારવાદનો પ્રભાવ પુરાણોમાં પણ પડ્યો છે. વાયુપુરાણ અને મત્સ્યપુરાણમાં શ્લોકમાં પાઠભેદ સાથે મળે છે. ભાગવતમાં અવતારનું બીજું પ્રયોજન મળે છે. અપ્રમેય, ગુણાર્થીન, ગુણાત્મક ભગવાનનો અવતાર માનવ કુલ્યાણ અને મોક્ષ માટે જ છે. અલૌકિક રાગાત્મિકા ભક્તિનું વિતરણ જ ભગવાનને પ્રકટ કરાવી શકે છે. શાનનું વિતરણ પણ ભગવાનના અવતારનું પ્રયોજન છે. ભગવાન જ ગુરુઓના ગુરુ છે. કદર્મ અને દેવહૂતિના ઘેર કપિલરૂપે અવતરેલા ભગવાને ભાગવતમાં કહ્યું છે કે, “જીવને મોક્ષ પ્રાપ્ત કરવો એ જ ભગવાનના અવતારનો મુખ્ય ઉદેશ છે.” ઈશ્વરનો અવતાર મનુષ્યોને સદગુણોનું શિક્ષણ આપવા માટે છે. ભગવાન વેદવ્યાસે ભાગવતમાં આ અંગે સ્પષ્ટ કહ્યું છે. આ રીતે સર્વવ્યાપક નિરાકાર ઈશ્વર માયારી ભક્તોની પ્રાર્થનાનુસાર ધર્મ, ગો, દેવ, સજ્જનોની રક્ષા માટે માનવાદિ, શરીરો ધારણ કરે છે. આ અંગે વિષ્ણુપુરાણમાં તથા રામચરિતના માનસમાં કહ્યું છે. જીવને મોક્ષ અપાવવો તે જ ભગવાનના અવતારનું મુખ્ય પ્રયોજન છે.

#### ૪. અવતારની પ્રક્રિયા

પુરાણ અને ઈતિહાસમાં બતાવી છે. ભગવાન પોતાની દિવ્યમૂર્તિનો ત્યાગ કરીને પૃથ્વી પર અવતરણ કરે છે. અને નવો જન્મ ધારણ કરીને કે જન્મ ધારણ કર્યા વિનારૂપ પરિવર્તનકારને અવતરે છે. આ ચર્ચા ભાગવતપુરાણમાં જોવા મળે છે. વિભુ પરમાત્મા, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સર્વજ્ઞ, સર્વશક્તિમાન સર્વવ્યાપી છે. પણ અવતારી સ્વરૂપે અશુદ્ધ, અબુદ્ધ, અવ્યક્ત, અલ્પશક્તિ છે. બીજા મત પ્રમાણે વિષ્ણુએ પોતાની મૂર્તિના બે ભાગમાં વિભાજન કર્યા પછી પહેલી મૂર્તિ સ્વર્ગમાં કઠોર તપ કરવા લાગી અને બીજી મૂર્તિ યોગનિદ્રાનો આશ્રય લઈને પ્રજાઓનો સંહાર તથા સૂષ્ટિ અંગે વિચાર કરવા લાગી. શ્રી નીલકંઠ પ્રથમ મૂર્તિને સાત્ત્વિક અને બીજી મૂર્તિને તામસી તરીકે ઉલ્લેખે છે. મહાભારતમાં પણ પ્રથમ મૂર્તિને વાસુદેવ તથા બીજી મૂર્તિને અંકર્ષણ માને છે. ત્રીજા મત પ્રમાણે સમસ્ત જગતમાં વ્યાપેલા નારાયણે પોતાની મૂર્તિને પણ ચાર ભાગમાં વિભાજિત કરી હતી. જેમાંથી એક મૂર્તિ નિર્ગુણ તથા બીજી ત્રણ સાગુણરૂપ છે. નિર્ગુણમૂર્તિનું નામ વાસુદેવ તથા સાગુણ મૂર્તિનાં નામ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરૂઢ છે. આ ચાર મૂર્તિઓને મહાભારતમાં કમશઃ: પુરુષ, જીવ, મન તથા અહંકાર કહે છે. આને ચક્કવ્યૂહ કહે છે. ઈશ્વરની

चित्कला उद्दिभज्ज, स्वटेज, अंडज, जरायुज, मानव, दानव, देवादि बधा पिंडोमां व्याप्त छे. जेम के उद्दिभज्ज ज्वोमां ईश्वरनी एक कला, स्वेदज्जमां बे कला, अंडजमां त्रष्ण कला अने जरायुज ज्वोमां चार कलाओ व्याप्त छे. सामान्य रीते मनुष्योमां पांचथी आठ कलाओनो विकास थाय छे. आठथी बधारे कलाओ अवतारनी कला कहेवाय छे. माटे ईश्वरनो अवतार नवथी सोण कलानो मानवामां आवे छे. नवथी पंदर कला सुधीनो अंशावतार अने सोण कणानो पूर्णावतार कहे छे. कृष्णवतारने पूर्णावतार कहेवाय छे. आम रामनो अवतार बार कणानो होवाथी अंशावतार कहेवाय छे. वामनादि अवतारने पङ्ग अंशावतार कहे छे-जेमां थोडा समय माटे भगवान शक्तिनो आवेशक लईने शक्तिथी अधिष्ठान करी जगतनुं भंगलभय कार्य करे छे. विशेषावतारमां दीक्षा समये गुरु-शिष्योना अंतःकारणमां विशेषरूपथी प्रगट थाय छे. आथी ते समये गुरु ब्रह्मादि रूप छे. सविशेषावतार तो क्यारेक थाय छे. सनकादि, नारद, पृथु वगेरे महापुरुषो आवा अवतारमां आवे छे. नित्यावतार मनुष्योना अंतःकरणमां थाय छे. सर्वत्र चराचरमां परमात्मानी सत्ता छे. आथी ते बधा ज्वोना हृदयमां बिराजमान छे. जेथी ज्व पापकर्मथी निवृत्ति लईने शुभ कार्योमां परोवाय छे.

अवतारोनो भीजा वर्ग 'अर्यावतार'ना नामे प्रसिद्ध छे. जेमां भगवाननी प्राण प्रतिष्ठा करेली प्रतिमाओ आवे छे. जे जुदा जुदा प्रकारना रूपोमां भक्तो द्वारा पूजाय छे. आ सिवाय भगवानना विभ्वावतार अने अंतर्यामी अवतार नामना बे अवतारोनी चर्चा जोवा मणे छे. जेमां विभावोनी संभ्या ओगणयालीस अहिर्भुद्यसंहितामां भतावी छे. उह तेमां मधुसूदन, पद्मनाभ, ध्रुव, कपिल वगेरे नामो आवे छे. अंतर्यामी अवतारमां कोई प्रत्यक्ष व्यक्तित्वनी कल्पना करवामां आवी नथी. तेना माटे कोई संभ्या निश्चित करवामां आवती नथी. अंतर्यामी तो सर्व प्राणीओना हृदयमां निवास करे छे. अवतारवादनी वधती लोकप्रियताए व्यूहोनुं महात्व घटाइयुं. व्यूहना चार अंगोमांथी फक्त वासुदेव मात्र रह्या. व्यूहवादी हवे अवतारवादना गुणावतार तथा अंतर्यामी अवतारनी आंशिक भावनाओ सुधी कोईने कोई रीते सीमित रह्यो.

#### प. अवतारोनी संभ्या

भिन्न भिन्न ग्रन्थोमां अवतारोनी संभ्या विभिन्न छे. क्यांक आठ, क्यांक दस, क्यांक सोण तो क्यांक योवीस अवतारोनो उल्लेख छे. परंतु दस मुख्य अवतार बहुमान्य छे. मत्स्य, कूर्म, वराह, नरसिंह, राम, परशुराम, वामन, राम, परशुराम, बलराम, कृष्ण, बुद्ध अने कल्कि. भागवतमां बावीस अवतार मनाया छे. गीतामां राम अने कृष्ण ऐम बे अवतारो जोवा मणे छे. महाभारतमां छ अवतारो जोवा मणे छे. अने भीजु जग्याए दस अवतारोनो उल्लेख छे. जेमां बुद्धनी जग्याए हंसनो उमेरो कर्यो छे. महाभारतनी दक्षिणात्य आवृत्तिना सभापर्वमां नाना चरित्रो साथे पुष्कर, वामन, कृष्ण, परशुराम, वराह, नृसिंह, दत्तात्रेय, दाशरथिराम अने कल्कि ऐम नव अवतारो गणावाया छे. श्रीमद्भागवतमां अवतारोनी संभ्या भिन्न भिन्न जोवा मणे छे. केटलीक जग्याए नव, यौद तो अन्यत्र वीस, बावीस के योवीसनी संभ्या भतावी छे. ए हरिना असंभ्य अवतारनी वात करी छे. प्रथम स्कंधना त्रीजा अध्यायमां श्लोक ह थी २४ सुधी सनकादि, नारद, वराह वगेरे बावीस अवतारोनो उल्लेख छे. जेम के द्वितीय स्कंधना सातमा अध्यायमां योवीस अवतारोनुं वर्णन छे. प्रथम अने द्वितीय स्कंधमां

વैषम्य जोतां द्वितीय संक्षेपमां “सुयज्ञ” ते यज्ञ છે. નારદને બદલે નારદના ઉપાસક હંસ છે. આમાં “મોહિની” નથી. ધ્રુવના પ્રભુ હયગ્રીવ, મનુવંશધર નવા છે. ભાગવત १.३ માં રામ અને કૃષ્ણ બિન્ન બતાવ્યા છે. જ્યારે ભાગવત २.७ માં સિતકૃષ્ણકેશ થી એક ગણ્યા છે. દસમા સંક્ષણના ચાલીસમાં અધ્યાયના શ્લોક ૧૭ થી ૨૨ માં ચૌદ અવતાર ગણ્યાવ્યા છે. તો આજ સંક્ષણના બીજા અધ્યાયના ચાલીસમાં શ્લોકમાં નવ અવતાર ગણ્યાવ્યા છે. અગિયારમા સંક્ષણના ચોથા અધ્યાયમાં વીસ અવતારોનું વર્ણન છે.

પાંચરાત્રની અહિર્બુધ્યસંહિતા (પૃ. ૪૭) માં ઉદ અવતારોના નામ મળે છે. આજે અવતારોની પ્રયાલિત સંખ્યા દસ છે. જેમાં નામ અને ક્રમ વામનપુરાણમાં છે. બારમી સદીમાં આ સંખ્યા નક્કી થઈ. અવતારના ચાર ભેદ છે. આવેશ, પ્રવેશ, સ્ફૂર્તિ અને આવિર્ભાવ પરમાત્માની વિભુશક્તિ કોઈક પ્રાણીમાં પ્રવેશે અને થોડીકવાર રહે તે આવેશ. કોઈ કાર્ય સંપન્ન કરવા સુધી રહે તે પ્રવેશ. મત્સ્ય, કૂર્મ અને વરાહ એ આવેશ અને પ્રવેશના ઉદાહરણ કહી શકાય. સ્ફૂર્તિ અવતારમાં બે વિરોધી પરિબળો ટકરાતા તેમાંથી જન્મે છે. પ્રહ્લાદની દૈવી શક્તિ અને હિરણ્યકાશિપુની આસુરી શક્તિ થાંભલા ઉપર ટકરાતાં નૃસિંહ અવતાર થયો છે. અને કોઈક દ્વારા જન્મ લેવો તે આવિર્ભાવ કરે છે. વામનથી જ બધા જ આવા અવતારો થાય છે. પરન્તુ આ અવતારોમાં પરમાત્માની શક્તિનું પ્રમાણ ઓછું વધતું જોવા મળે છે. મત્સ્ય, કૂર્મ, વામન અને વરાહમાં પરમાત્માના ચાર અંશની શક્તિ છે. કેવળ કૃષ્ણાવતારને જ પૂર્ણાવતાર તરીકે જયદેવ વગેરેએ માન્યો છે. સંપૂર્ણ: કેવળો હરિ: પરંપરાને અનુસરીને જયદેવ ગીતગોવિંદમાં કહ્યું છે. દશાકૃતિકૃતે કૃષ્ણાય તુભ્યં નમઃ । દશ અવતારો ગણ્યાવવામાં બલરામને પણ અવતાર ગણ્યાયો છે. અને બુદ્ધને પણ સમાવવામાં આવ્યા છે. દશ મુખ્ય અવતારો હોવાથી તેમના વિશે અહીં વિગતો સમાવવામાં આવ્યા છે. દશ મુખ્ય અવતારો હોવાથી તેમના વિશે અહીં વિગતો આપવામાં આવી છે.

#### ૬. દસ અવતાર અને તેમનું કાર્ય

##### ૧. મત્સ્યાવતાર

ચાતુર્યુગ પૈકી સત્યયુગમાં નૈમિત્તિક પ્રલય સમયે વૈવસ્વત મનુના સહયોગથી જલમળ વેદ સૃષ્ટિની રક્ષા માટે મત્સ્યરૂપે અવતાર થયો હતો.

##### ૨. કૂર્માવતાર

સત્યયુગમાં સમુદ્રમંથન સમયે મન્દરાચલ પર્વતને પોતાની પીઠ પર રાખીને અમૃતમંથન પ્રસંગે આ અવતાર થયો હતો.

##### ૩. વરાહાવતાર

હિરણ્યકાશિપુને મારીને પ્રહ્લાદની રક્ષા માટે સત્યયુગમાં આ અવતાર થયો હતો.

##### ૪. નૃસિંહાવતાર

હિરણ્યકાશિપુને મારીને પ્રહ્લાદની રક્ષા માટે સત્યયુગમાં આ અવતાર થયો હતો.

##### ૫. વામનાવતાર

ભગવાન વિષ્ણુએ દૈત્યરાજભલિને સ્વર્ગમાંથી પાતાલમાં મોકલ્યો.

#### ૬. પરશુરામાવતાર

ભગવાન વિષ્ણુએ અત્યાચારી અને બ્રાહ્મણ દેખી સહસ્રબાહુ કાર્ત્વીર્ય અર્જુનને મારવા ત્રેતાયુગમાં પરશુરામનો અવતાર ધારણ કર્યો હતો.

#### ૭. રામાવતાર

સંસારમાં આદર્શ જીવનનું ઉદાહરણ પુરું પાડનાર આ રામનો અવતાર છે. આ રામાવતારને મર્યાદાવતાર માનવામાં આવે છે. તે બાર કળાનો અવતાર છે.

#### ૮. કૃષ્ણાવતાર

દ્વાપરયુગમાં અંત સમયમાં કંસ, દુર્યોધન, દુઃશાસન વગેરેના નાશ માટે દેવકીના ગર્ભથી કૃષ્ણારૂપે અવતરીને અત્યાચારોના અંત માટે આ અવતાર લીધો હતો. કૃષ્ણ સ્વયંભગવાન છે. તેથી કૃષ્ણાવતારને પૂર્ણાવતાર પણ કહેવાય છે.

#### ૯. બૌદ્ધાવતાર

ભગવાને બુદ્ધાવતાર લઈને પશુહત્યાથી ઉત્પન્ન અધર્મને રોકવા આ અવતાર લીધો.

#### ૧૦. કલિકાવતાર

આ અવતાર થયો નથી. ભાગવ ૧/૩/૨૫ માં કહ્યું છે કે જ્યારે આ સંસારમાં પાપ વધી પડશે. મનુષ્ય અધાર્મિક બનશે ત્યારે ભગવાન કલિકરૂપે અવતરશે. જયદેવ ગીતગોવિંદમાં કૃષ્ણાના સ્થાને બલરામને ગણીને કૃષ્ણને પૂર્ણાવતાર તરીકે વર્ણવામાં આવે છે. વિષ્ણુપુરાણના પાંચ અંશ છે તેમાં રાજા વેનના ચરિત્રના સંદર્ભ પૂછુનું ચરિત્ર આલેઘ્યું છે.

પૃથુને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. વિષ્ણુના અન્ય અવતારોમાં નૃસિંહ અવતાર વધુ લોકપ્રિય બન્યો છે. વિ.પુ.ના પ્રથમ અંશના અ. સોળથી વીસમાં નરસિંહ અવતાર વિષયક પ્રશ્નના ઉત્તરમાં હિરણ્યકાશિપુનો દિગ્વિજય, પ્રહ્લાદનું ચરિત્ર, પ્રહ્લાદને મારવા માટે હિરણ્યકાશિપુના પ્રયત્નો, પ્રહ્લાદ ભક્ત હોવાથી તેના રક્ષણ માટે ભગવાને મોકલેલું સુદર્શન ચક અને પ્રહ્લાદની સ્તુતિથી ભગવાનનો આવિર્ભાવ વર્ણવવામાં આવ્યો છે. આમ, નૃસિંહ અવતાર દશાવતાર લીલામાં ચોથો અવતાર છે. આ પછી મનુના અવતારોની કથા છે. પણ ત્રીજા અંશમાં ક્યાંય મત્સ્યાવતારની કથા મળતી નથી. વિષ્ણુપુરાણના ચોથા અંશમાં સૂર્ય અને ચંદ્ર વંશનું વર્ણન છે. જેમાં ચોથા અંશના ચોથા અધ્યાયમાં સાગર, સૌદાસ, ખટ્ટવાંગના, ચરિત્ર સાથે રામનું ચરિત્ર સંક્ષેપમાં આપવામાં આવ્યું છે. વિષ્ણુપુરાણમાં ૪.૮૭ થી ૧૦૩ માં રામચરિત આપવામાં આવ્યું છે. રામના બે પુત્રો કુશ અને લવ, લક્ષ્મણના અંગજ અને ચંદ્રકેતુ, ભરતના તષ્કલ અને પુષ્કલ, શત્રુધના સૂરબાહુ અને સૂરસેનને વર્ણણી કુશથી સાગર ચાલેલા વંશનું વર્ણન કરવામાં આવ્યું છે.

ચોથા અંશમાં યદુવંશના વર્ણનમાં કોષુ અને સાત્વતનું વર્ણન કરતાં વસુદેવની સંતતિનું વર્ણન સંક્ષેપમાં આવ્યું છે. વિષ્ણુપુરાણનો પાંચમો અંશ અધ્યાય ૧ થી ૩૮ સુધી શ્રીકૃષ્ણનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. આ ચરિત્રની બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણવેલા શ્રીકૃષ્ણચરિત્ર સાથે તુલના અધ્યયનનો વિષય છે.

## ૭. બ્રહ્મવૈવર્ત પુરાણ

વિષ્ણુના વિભિન્ન અવતારોમાં કેવળ ધ્વન્તરી અવતારનું વર્ણન મળે છે. બ્રહ્મવૈવર્ત પુરાણનો ચતુર્થખંડ શ્રીકૃષ્ણ જન્મખંડ છે. અને સમગ્ર બ્રહ્મવૈવર્ત પુરાણના આ ચતુર્થ ખંડમાં શ્રીકૃષ્ણનું જન્મચરિત્ર નિરૂપવામાં આવ્યું છે. વિ.પુ. અને શ્રીમદ્ભાગવતના જેવું શ્રીકૃષ્ણ ચરિત્ર હોવા ઉપરાંત શ્રીકૃષ્ણ અને રાધાના પ્રણયપ્રસંગોનું આલેખન તેના આધ્યાત્મિક રહસ્ય સાથે કરવામાં આવ્યું છે. ગોલોકનું વર્ણન એ તેમની નિત્યલીલા વિષે છે. પૃથ્વી ઉપર ગોપીઓમાં રાધા પ્રતિ વિશેષ પ્રેમ આલેખન કરવામાં શ્રીકૃષ્ણની સાથે રાધા શાપિત બનીને અવતરી છે. પરિણામે રાધા માધવની કિયા દુન્યવી દટ્ઠિને પ્રણયપ્રસંગ છે. પરંતુ ગોલોકમાં રાધાનું વર્ણન દિવ્યતાના રંગે રંગાયેલું છે. આમ, રાધા તત્વને પરમાત્માની આહ્લાદિની શક્તિ તરીકે અહીં નિરૂપવામાં આવી છે. વિષ્ણુના અવતારોમાં શ્રીકૃષ્ણને મહત્વનો સોળ કળાવાળો પૂર્ણવતાર માનવામાં આવે છે. જ્યદેવે ગીતગોવિંદમાં અષ્પદીના અંતે “દશાકૃતિકૃતે કૃષ્ણાય તુભ્યં નમઃ” કહીને દશે અવતારો એ શ્રીકૃષ્ણના જ હોવાનું બતાવાયું છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં જ પણ વિષ્ણુના સ્થાને શ્રીકૃષ્ણને પરમતત્ત્વ તરીકે નિરૂપવામાં આવ્યા છે. અને પૂર્ણ પુરુષોત્તમ તરીકે પણ બ્રહ્મવૈવર્ત પુરાણમાં આલેખન થયું છે.

## ૮. અવતારવાદની ફલશ્રુતિ

ડાર્વિનના ઉત્કાંતિવાદની દટ્ઠિએ અવતારતત્ત્વનું વર્ગીકરણ થઈ શકે છે. પ્રથમ બુદ્ધિહીન નાના પ્રાણીઓ પાણીમાં ઉત્પન્ન થયા પછી જળ અને સ્થળ બંને પર ફરનારાં પ્રાણીઓનો વિકાસ થયો. આ જ રીતે અવતાર તત્ત્વની સમીક્ષામાં મત્સ્યાવતાર જલીય પ્રાણીઓનું પ્રતીકૃષ્ણે. ત્યારબાદ જળ અને સ્થળ બંને પર રહેનારા જીવોનું સર્જન કર્યું જેનું પ્રતિનિધિત્વ કૂર્મ કરે છે. ત્યાર પછી સ્થળ ઉપર રહીને જીવન વિતાવે તેવાં પ્રાણીઓના પ્રતિનિધિત્વ રૂપે વરાહશૂકરને માને છે. ત્યારપછી મનુષ્ય અને પશુત્વ અવતાર આવે છે તેવા પ્રાણીનું પ્રતિનિધિત્વ કરનાર નૃસિંહનો અવતાર થયો. ત્યારપછી માનવ આવિર્ભૂત થયો. પણ તે લઘુકાય હોય છે. તે વામનરૂપ આનું પ્રતિનિધિત્વ કરે છે. વામનાવતાર પછી મનુષ્યના ભયાનક રૂપનું પ્રતિનિધિત્વ કરનાર પરશુરામનો અવતાર થયો. દશરથ રામ મર્યાદા પુરુષોત્તમ છે. જેમનામાં માનવજીવનની સમગ્ર મર્યાદાઓનો વિકાસ થયેલો છે. કૃષ્ણનો સમગ્ર સૂચિના શ્રેયકર, જ્ઞાની, ઐશ્વર્ય અને વૈરાગ્યના પ્રતિનિધિત્વ છે. બુદ્ધમાં કૃપાની અધિકતા છે. જે મનુષ્ય શત્રુને બળનો પ્રયોગ ન કરીને કરણા, મૈત્રી દ્વારા વશ કરે છે. જ્યારે પ્રાણી ઈશ્વરની કૃપા-કરુણાથી વશ થતો નથી. ત્યારે કલિના રૂપે માનવને અકૃપારૂપનો સાક્ષાત્કાર થાય છે. અવતારલીલાથી સમાજને સુવ્યવસ્થિત અને આચારનિષ્ઠ બનાવવાનો ઉદેશ અવતારના પ્રયોજનમાં સહૂરે છે. આ દશાવતારમાં નવેય રસોનું વિશીષ્ટ મહત્ત્વ રહેલું છે. જેમાં શ્રીકૃષ્ણ શુંગારરસ, વામન હાસ્યરસ, મત્સ્યકરુણ રસ, વરાહ બીજતસ, નૃસિંહ ભયાનક રસ, રામ વીરરસ, પરશુરામ રૌદ્રરસ, કૂર્મ

અદ્ભુતરસ અને બુદ્ધ શાન્તરસનું પ્રતિનિધિત્વ કરે છે. વિ.પુ.માં વર્ણવેલી શ્રીકૃષ્ણની બાલ, પૌગંડ, યુવા અને દ્વારકાલીલાનું અધ્યયન અને સમીક્ષા આ પછીના પ્રકરણમાં કરવામાં આવે છે.

## વાચન સામગ્રી

૧. અવે તૃખોયજ् 3.3.20 અવ ઉપપદે તૃસ્તુભ્યાંકરणાધિકરણયો: પુંસિ સંજ્ઞાયાં યગ્સ્યાતુ । (સિદ્ધાંતકૌમુદી - તત્ત્વબોધિની ટીકા પૃ. 656)
૨. મહાભારતિવંશપર્વ 41.17.20, ભા.પુ. 10.32.2
૩. શ્રી નાગેન્દ્રનાથ - હિન્દી વિશ્વકોશ પૃ. 179
૪. શ્રી ધીરેન્દ્ર વર્મા, અવતરણમવતાર હિન્દી સાહિત્યકોશ ભાગ-1
૫. (અ) અજાયમાનો બહુધા વિજાયતે । (યજુ. 31.1)
   
(બ) ભગવદ્ગીતા - 4.6
૬. ઇન્દ્રા માયાભિઃ પુરુરૂપ ઈયતે । (ત્રણ. 6.47.18)
૭. રૂપં રૂપં મઘવા બોભવીતિ માયાઃ કૃણવામસ્તન્વપરિસ્તવામ् । (ત્રણ. 3.53.8)
   
રૂપં રૂપં પ્રતિરૂપો બભૂવ તદસ્ય રૂપં પ્રતિયક્ષણાય ઇન્દ્રો માયાભિઃ પુરુરૂપં ઈયતે યુક્તા હૃયસ્ય હસ્યઃ રાતદશ ॥
   
(ત્રણ. 6.47.18)
૮. શૃંગાવૃષા નામ કરિવદ् ઋષિઃ । તસ્ય ચન્દ્રઃ સ્વયમેવ પુત્રતયા તયા જરા ઇત્યાખ્યાયિકા । સાયણભાષ્ય (ત્રણ. 8.17.13)
૯. ઇદं વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમ् । સમૂઢમસ્ય પાંસૂર (ત્રણ. 1.22.17)
૧૦. યદપ્રવીતા દધતે હ ગર્ભ તદા ચિઞ્ચગતો..... । (ત્રણ. 47.78)
૧૧. ત્વં સ્ત્રી ત્વં પુમાનિ ત્વં કુમાર ઉત કુમારી । (અથવ. 18.8.27)
૧૨. વરાહેણ પૃથિવી સંવિદાના । (અથવ. 12.1.48)
૧૩. ઉપજ્મન્ત્રપેતસેતઽવર નદીષ્વા ॥ (યજુ. 17-6)
૧૪. પ્રજાપતિસ્ત્વરતિ ગર્ભેઽન્તર જાયમાનો બહુધા વિજાયતે । (શુક્લ. યજુ. સં. 3.1.19)
૧૫. વામનો હ વિષ્ણુરાક્ષ । (શ.પ્રા. 1.2.5-7)

१६. मनवे ह वै प्रातः मत्स्यः सहापाणी आपदे सहारमैव त्वमुवाच बिभृहि माम् पारयिष्यामि कस्मान्माम्

पारयिष्यसिति औघ इमां सर्वा प्रजा निर्वोढा ततस्त्वा पारयिताऽस्मि ।

(श.भ्रा. 18.1.1)

१७. स यत् कूर्मो नाम एतद् वै रूपं कृत्वा प्रजापिता प्रजा असृजत् । (श.भ्रा. 7-5.1.5)

१८. आपो वा इदमग्ने सलिलमासीत् तस्मिन् प्रजापतिवायुर्भूत्वा चरत्स ह मामपश्यत् तं वराहो भूत्वाऽहरत् स वराहो रूपं कृत्वा पन्यमज्जन् स पृथिवीमध्य अन्वर्ष्टत् । उद्धृताऽसि कृष्णेन शतबाहुना । (ते.भ्रा. 7.1-5.1)

१९. अन्तरतः कूर्मभूत प्रयत्नं तमब्रवीत् मम वै त्वऽमांसान् समभूत् ।

तत् पुरुषस्य पुरुषत्वम् । स सहस्रशीर्षाः पुरुषः सहस्राक्षः सहस्रपात् भूत्वादेतिष्णुत् । (ते.सा. 1.23.3)

२०. वज्रनखाय विद्महे तीक्ष्णदंष्ट्राय धीमहि । तनो नरसिंहः प्रचोदयात् । (ते.आ. 1.1.31)

२१. अ. ऋग्वेद 1.154-2, 154.5

२२. नारायणाय विद्महे वासुदेवाय धीमहि । तनो विष्णुः प्रचोदयात् । (ते.आ. 1.1.31)

२३. वासुदेवार्जुनाम्यां वुन् । (सिद्धांत कौ. 4.3.98)

२४. अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् । प्रकृतिं स्वामिधिष्ठाय संभवाम्यात्ममायया ॥ (भ.गी. 4-6)

२५. कृष्णाय देवकीपुत्राय । (धर्म. ३४. 3.18.6)

२६. मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव । (भ.गी. 7.7)

२७. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाऽत्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ (भ.गी. 4.7.8)

२८. जज्ञे पुनः पुनविष्णुर्यज्ञे च शिथिले प्रभुः । कर्तुः धर्मव्यवस्थानमद्यर्मस्य च नाशनम् । (भा.पु. 98.68)

२९. भा.पु. 47.235

३०. नृणां निःश्रेयसार्थाथ व्यक्तिर्भगवतो नृप । अव्यवस्थाप्रमेयस्य निर्गुणस्य गुणात्मनः ॥ (भा.पु. 10.29.14)

३१. एतन्मे जन्म लोकेऽस्मिन् मुमुक्षुणां दूराशयात् । प्रसंख्यानाय तत्वानां सम्मतायात्मदर्शने ॥ (भा.पु. 3.24.36)

कपिलस्तत्त्वसंख्याता भगवान् आत्ममायया । जातःस्वयमजः साक्षादात्मप्रज्ञस्तये नृणाम् ॥ (भा.पु. 3.25.1)

३२. मर्त्यावतारास्त्वह मर्त्यशिक्षणं रक्षोऽवधायैव न केवलं विभोः । (भा.पु. 5.19.5)

- उ३. एतदर्थं तु लोकेऽस्मिन्नवतारः कृतो मया । (वि.पु. 5.7.9) विप्रधेनुशूरद्रांतहित..... मनुजवतार । (राम्यरित  
मानस संत तुलसीदास)
- उ४. त्यक्त्वा दिव्या तनु विष्णुर्मानुषेष्विह जायते । युगे त्वथ परावृते काले प्रशिथिले प्रभुः ॥ (भा.पु. 47.34)
- उ५. एते चांशकलाः पुंस कृष्णस्तु भगवान् स्वयम् । (भा.पु. 1.3.28)
- उ६. अष्टि. सं. पृ. 47
- उ७. रामः शश्वमृतामहम् । (भ.गी. 10.31) वृष्णिनां वासुदेवोऽस्मि । (भ.गी. 10.37)
- उ८. भषा.शी. 339.77.102
- उ९. हंसः कूर्मश्च मत्स्यश्च प्रादुर्लावाद् द्विजोत्तम् । वराहो नरसिंहस्य वामनो राम एव च । रामो दाशरथिस्त्वे सात्वतः  
कल्किरेव च । (भ.षा.शी. ५१३ 339.103, 104)
१०. अवतारा ह्यसंख्येयाः हरेः सत्त्वनिधेद्विजाः । (भा.पु. 1.3.26)
११. मत्स्य कूर्मो वराहश्च नृसिंहो वामनस्तथा । रामो रामश्च कृष्णश्च बुद्धः कल्किर्दश स्मृताः । (वा.पु. 52.26)  
मत्स्यः कूर्मो वराहश्च नरसिंहोऽथ वामनः । रामो रामश्च कृष्णश्च बुद्धः कल्की च ते दश । (वा.पु. 4.2)